

ગંગા સતીનાં કાવ્યો

1.

મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે,
ભાંગી રે પડે ભરમાંડ રે,
વિપત પડે પણ વણસે નહીં,
ઈ તો હરિજનનાં પરમાણુ રે.

હરખ ને શોકની ના'વે જેને હેડકી ને,
શીશ તો કર્યાં કુરબાન રે.
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
જેણે મેલ્યાં અંતરના માન રે.

નિત્ય રહેવું સતસંગમાં ને
જેને આઠે પો'ર આનંદ રે
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં
જેણે તોડી નાંખ્યો માયા કેરો ફંદ રે

ભક્તિ કરો તો એવી કરજો પાનબાઈ
રાખજો વચનુંમાં વિશ્વાસ રે
ગંગા રે સતી એમ બોલિયા
તમે થાજો સતગુરુજીના દાસ રે

2.

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે, પાનબાઈ !
નહિતર અચાનક અંધારા થાશે જી,
જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઈ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી.

જાણ્યા રે જેવી આ તો અજાણ છે, પાનબાઈ !
અધૂરિયાને નો કે'વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય જી.

મન રે મૂકીને તમે આવો મેદાનમાં, પાનબાઈ !
જાણી લીયો જીવ કેરી જાત જી;

સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી.

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ, પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં,
ત્યાં નહિ માયાનો જરીએ લેશ જી.

3.

ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું ને,
મેલવું અંતરનું અભિમાન રે,
સતગુરુ ચરણમાં શીશ નમાવી,
કર જોડી લાગવું પાય રે.

જાતિપણું છોડીને અજાતિ થાવું ને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિ ને ભ્રાંતિ નહીં અહીંના દેશમાં,
એવી રીતે રહેવું નિર્માન રે.

પારકા અવગુણ કોઈના જુએ નહીં ને,
એને કહીએ હરિ કેરા દાસ રે,
આશા ને તૃષ્ણા એકે નહીં ઉરમાં,
એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે.

ભક્તિ કરો તો એવી રીતે કરજો
રાખજો વચનમાં વિશ્વાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં,
એને કહીએ હરિ કેરા દાસ રે.

4.

જીવ ને શિવની થઈ એકતા ને,
પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,
દ્વાદશ પીઠો જણે પ્રેમથી તે,
સમાઈ રહ્યો સુનની માંચ રે.

તમે હરિ હવે ભરપૂર ભાળ્યા ને,

વરતો કાયમ ત્રિગુણથી પાર રે,
રમો સદા એના સંગમાં
ને સુરતા લગાડો બાવન બાર રે.

મૂળ પ્રકૃતિથી પાર થઈ ગયા ને,
તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું,
ને જ્યાં વરસો સદા સ્વાંત રે.

સદા આનંદ હરિના સ્વરૂપમાં જે
જ્યાં મટી મનની તાણાવાણ રે,
ગંગા રે સતી એમ બોલિયાં,
તમે પદ પામ્યા નિર્વાણ રે.